

☐ વ્યવસાય લોન

☐ SME સુરક્ષિત લોન

☐ મશીનરી લોન

કૃપા કરીને કીપટલ અક્ષરોમા બધા જરૂરા લિંગતો ભરો. લાગુ પડતા ☒ બાકસન લટક કરો.

ECL ફાઇનાન્સ લિમિટેડ ☐ એડલવાઇસ લિમિટેડ ફાઇનાન્સ લિમિટેડ ☐

☐ અરજીનો નંબર: _____

અરજદારની માહિતી

1. અરજદારનું નામ: _____

2. ઉધાર લેનાર એન્ટિટીનો પ્રકાર: _____

3. એન્ટિટીનું રજિસ્ટર્ડ ઓફિસ સરનામું: _____

4. એન્ટિટીનું સંદેશાવ્યવહાર સરનામું ☐ હા (ઉપરની જેમ જ) ☐ ના

5. સ્વીકાર્ય KYC દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે,

☐ S&E એક્ટ હેઠળ મ્યુનિસિપલ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર/વાયસન્સ/મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલ એન્વિસ્ટમેન્ટ/વાયસન્સ/દુકાન ફાળવણી પત્રનું પ્રમાણપત્ર

☐ ફાળવણી પત્રનું પ્રમાણપત્ર. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના સત્તામંડળ/વિભાગ દ્વારા જારી કરાયેલ કોઈપણ સત્તા/ વિભાગ,

☐ GST/VAT/TIN/TAN/પૂરાવો. હેઠળ નોંધણી પ્રમાણપત્ર ટેક્સ ઓથોરિટી/શ્રમ કાયદો/ફેક્ટરી નોંધણી પ્રમાણપત્ર

☐ ભાગીદારી ડીડ અને નોંધણી પ્રમાણપત્ર, (જો પેઢીઓ માટે નોંધાયેલ હોય તો) /MOA અને AOA (Co's માટે) સાથે Incનું પ્રમાણપત્ર અને વ્યવસાયની શરૂઆતનું પ્રમાણપત્ર (PLCના કિસ્સામાં)

☐ દસ્તાવેજનો પ્રકાર અને નંબર: _____ સમાપ્તિ તારીખ (જો લાગુ હોય તો): _____

6. વ્યવસાય શરૂ કરવાની તારીખ: _____ 7. વ્યવસાયના સમાવેશની તારીખ: _____ 8. કર્મચારીઓની સંખ્યા _____

9. વેપારનું સ્થળ: _____ 10. PAN: _____

11. CIN: _____ 12. GST નંબર : _____

13. CKYC: નવું _____

14. CKYC નંબર: _____

15. વ્યવસાયની પ્રકૃતિ _____

16. નોન પ્રોફેશનલ ☐ વ્યવસાયિક ☐ ડોક્ટર ☐ CA/CS/CWA ☐ આર્કિટેક્ટ ☐ વકીલ ☐ અન્ય _____

17. સંપર્ક વ્યક્તિનું નામ: _____ હોદ્દો: _____

લેન્ડલાઇન નંબર: _____ મોબાઇલ નં.: _____ ઇમેઇલ ID _____

પ્રોપ્રાઇટર/પાર્ટનર્સ/પ્રોપ્રાઇટરશિપ કન્સર્ન/પાર્ટનરશિપ ફર્મ/LLP/પ્રાઇવેટ લિમિટેડ કંપની/પબ્લિક લિમિટેડ કંપનીના ડિરેક્ટર્સની વિગતો

નામ	સરનામું	નફો વહેંચણી%	કુલ અનુભવ	PAN	DIN

સહ-અરજદાર - I માહિતી

1. નામ _____

2. પિતા/પત્નીનું નામ _____

3. માતાનું નામ _____

4. જન્મ તારીખ: _____ વૈવાહિક સ્થિતિ ☐ હા ☐ ના

5. PAN : _____

ભારતના નાગરિક ☐ હા ☐ ના

લિંગ : _____

6. અપંગતા જો ☐ શારીરિક ખામી ☐ દૃષ્ટિની ખામી ☐ અન્ય જો કોઈ હોય તો (કૃપા કરીને સ્પષ્ટ કરો)

7. CKYC એપ્લિકેશનનો પ્રકાર: _____

8. CKYC નં.: _____

9. ID દસ્તાવેજ પ્રકાર _____

10. સંબંધિત ID નંબર: _____

11. ઉદ્યોગ: _____

12. આવકનો સ્ત્રોત: _____

13. આવકની રેન્જ: _____

14. પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સની સમાપ્તિ તારીખ: _____

સહ-અરજદાર - II માહિતી

1. નામ _____

2. પિતા/પત્નીનું નામ _____

3. માતાનું નામ _____

4. જન્મ તારીખ: _____ વૈવાહિક સ્થિતિ ☐ હા ☐ ના

5. PAN : _____

ભારતના નાગરિક ☐ હા ☐ ના

લિંગ : _____

6. અપંગતા જો ☐ શારીરિક ખામી ☐ દૃષ્ટિની ખામી ☐ અન્ય જો કોઈ હોય તો (કૃપા કરીને સ્પષ્ટ કરો)

7. CKYC એપ્લિકેશનનો પ્રકાર: _____

8. CKYC નં.: _____

9. ID દસ્તાવેજ પ્રકાર _____

10. સંબંધિત ID નંબર: _____

11. ઉદ્યોગ: _____

12. આવકનો સ્ત્રોત: _____

13. આવકની રેન્જ: _____

14. પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સની સમાપ્તિ તારીખ: _____

10. રહેઠાણનું સરનામું _____

શહેર _____ પિન કોડ

રાજ્ય _____

11. વર્તમાન સરનામાં પરના વર્ષો _____ ભાડે ☐ પોતાનું ☐

કંપની દ્વારા આપેલ ☐ અન્ય ☐ _____

12. કાયમી સરનામું _____

શહેર _____ પિન કોડ

રાજ્ય _____

STD કોડ _____ ટેલિ નં. _____ મોબાઇલ _____

ઇમેઇલ _____

13. શૈક્ષણિક લાયકાત ☐ UG ☐ ગ્રેજ્યુએટ ☐ PG

જો વ્યવસાયિક ☐ CA ☐ ડોક્ટર ☐ આર્કિટેક્ટ ☐ વકીલ

☐ અન્ય _____

14. જન્મનો દેશ: _____

15. રહેઠાણનું સ્ટેટસ: _____

16. શું તમે US નિવાસી છો?: _____

17. શું તમે US નાગરિક છો?: _____

18. શું તમારી પાસે US કાયમી નિવાસી કાર્ડ (ગ્રીન કાર્ડ) છે?: _____

19. જો 1 થી 3 સુધીના કોઇપણ પ્રશ્નોના જવાબ હા છે તો કૃપા કરીને: _____

20. તમારો ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર પ્રદાન કરો જે ફોર્મ W9માં તમારો સામાજિક સુરક્ષા નંબર છે

21. શું તમે રાજકીય રીતે જાણીતા વ્યક્તિ (PEP) છો ☐ હા ☐ ના

22. શું તમે કોઇ પણ નોંધાયેલી બેંક અથવા તેની જૂથ કંપનીઓના ડિરેક્ટર છો? ☐ હા ☐ ના

સહ-અરજદાર - I માહિતી (બિન-વ્યક્તિગત)

1. નામ: _____

2. ઇન્કોર્પોરેશનની તારીખ: _____

3. PAN: _____

4. ઉદ્યોગ: _____

5. આવકનો સ્ત્રોત: _____

6. આવકની રેન્જ: _____

7. સેગમેન્ટ: _____

8. આઇડી દસ્તાવેજ પ્રકાર: _____

9. વ્યાપારનું માળખું: _____

10. જી.એસ.ટી.: _____

11. વર્તમાન સરનામાં પરનું વર્ષ: _____

12. મોબાઇલ: _____

13. ઇમેઇલ આઇડી: _____

14. કંપનીનું સંપર્ક નામ: _____

10. રહેઠાણનું સરનામું _____

શહેર _____ પિન કોડ

રાજ્ય _____

11. વર્તમાન સરનામાં પરના વર્ષો _____ ભાડે ☐ પોતાનું ☐

કંપની દ્વારા આપેલ ☐ અન્ય ☐ _____

12. કાયમી સરનામું _____

શહેર _____ પિન કોડ

રાજ્ય _____

STD કોડ _____ ટેલિ નં. _____ મોબાઇલ _____

ઇમેઇલ _____

13. શૈક્ષણિક લાયકાત ☐ UG ☐ ગ્રેજ્યુએટ ☐ PG

જો વ્યવસાયિક ☐ CA ☐ ડોક્ટર ☐ આર્કિટેક્ટ ☐ વકીલ

☐ અન્ય _____

14. જન્મનો દેશ: _____

15. રહેઠાણનું સ્ટેટસ: _____

16. શું તમે US નિવાસી છો?: _____

17. શું તમે US નાગરિક છો?: _____

18. શું તમારી પાસે US કાયમી નિવાસી કાર્ડ (ગ્રીન કાર્ડ) છે?: _____

19. જો 1 થી 3 સુધીના કોઇપણ પ્રશ્નોના જવાબ હા છે તો કૃપા કરીને: _____

20. તમારો ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર પ્રદાન કરો જે ફોર્મ W9માં તમારો સામાજિક સુરક્ષા નંબર છે

21. શું તમે રાજકીય રીતે જાણીતા વ્યક્તિ (PEP) છો ☐ હા ☐ ના

22. શું તમે કોઇ પણ નોંધાયેલી બેંક અથવા તેની જૂથ કંપનીઓના ડિરેક્ટર છો? ☐ હા ☐ ના

સહ-અરજદાર - II માહિતી (બિન-વ્યક્તિગત)

1. નામ: _____

2. ઇન્કોર્પોરેશનની તારીખ: _____

3. PAN: _____

4. ઉદ્યોગ: _____

5. આવકનો સ્ત્રોત: _____

6. આવકની રેન્જ: _____

7. સેગમેન્ટ: _____

8. આઇડી દસ્તાવેજ પ્રકાર: _____

9. વ્યાપારનું માળખું: _____

10. જી.એસ.ટી.: _____

11. વર્તમાન સરનામાં પરનું વર્ષ: _____

12. મોબાઇલ: _____

13. ઇમેઇલ આઇડી: _____

14. કંપનીનું સંપર્ક નામ: _____

ગીરો/પૂર્વધારણા કરવા માટે જરૂરી લોન અને મિલકત/સંપત્તિ(ઓ)ની વિગતો

1. મિલકતનો પ્રકાર/સંપત્તિ(ઓ) ☐ રહેણાંક ☐ વાણિજ્યિક ☐ મિશ્રિત વપરાશ ☐ સાધનો | જો મિલકત હોય તો સંપત્તિ(ઓ)ની સ્થિતિ ☐ સ્વ-વ્યવસાય ☐ ભાડે ☐ ખાલી

2. જરૂરી લોન રકમ ₹ _____ વર્ષમાં જરૂરી કાર્યકાળ _____

મિલકત/સંપત્તિ(ઓ)નું મૂલ્ય ₹ _____ બિલ્ટ-અપ એરિયા (ચો. ફૂટ) _____

3. મિલકતનું સરનામું _____

શહેર _____ પિન કોડ _____ રાજ્ય _____

4. મિલકતના માલિક: ☐ અરજદાર ☐ સહ-અરજદાર ☐ સંયુક્તરીતે ☐ અન્ય

જો સંયુક્ત રીતે/અન્ય તો કૃપયા માલિકના નામનો ઉલ્લેખ કરો _____

5. લોનનો હેતુ ☐ મૂડી ખર્ચ ☐ કાર્યકારી મૂડી ☐ વાણિજ્યિક/ઔદ્યોગિક મિલકતની ખરીદી ☐ વ્યવસાય વિસ્તરણ ☐ નવા સાધનની ખરીદી

☐ હાલના સાધનોનું પુનર્ધોરણ

બેંક એકાઉન્ટની વિગતો

ખાતાધારકનું નામ	બેંકનું નામ	શાખા	ખાતું આ તારીખથી સંચાલિત	ખાતા નં.	વ્યક્તિગત/સંયુક્ત ખાતું	સુવિધાની પ્રકૃતિ (OD/TL/CC)

વીમા આવશ્યકતા (વૈકલ્પિક) / વધારાની માહિતી

1. ગ્રૂપ વીમા કવર - લોન ☐ હા ☐ ના

2. અન્ય વીમા કવર ☐ હા ☐ ના

3. આયાતકાર / નિકાસકાર ☐ હા ☐ ના

4. આયાત / નિકાસ ટર્નઓવર: ₹ _____

વેપાર સંદર્ભ

1. એન્ટિટીનું નામ_____

2. સંપર્ક વ્યક્તિ_____

3. અરજદાર સાથેનો સંબંધ: ☐ સપ્લાયર ☐ ગ્રાહક ☐ હરીફ

☐ અન્ય (સ્પષ્ટ કરો)_____

4. સરનામું: _____

વેન્ડમાર્ક _____ શહેર _____

પિન કોડ _____ રાજ્ય _____

STD કોડ _____ ટેલિ નં. _____

મોબાઇલ _____ ઇમેઇલ _____

બિન વેપાર સંદર્ભ

1. નામ_____

2. સંપર્ક વ્યક્તિ_____

3. અરજદાર સાથેનો સંબંધ: ☐ મિત્ર ☐ સંબંધીઓ ☐ પડોશી

☐ અન્ય (સ્પષ્ટ કરો)_____

4. સરનામું: _____

વેન્ડમાર્ક _____ શહેર _____

પિન કોડ _____ રાજ્ય _____

STD કોડ _____ ટેલિ નં. _____

મોબાઇલ _____ ઇમેઇલ _____

પ્રક્રિયા ફીની વિગતો

રકમ*: ₹

(પ્રકૃતિમાં બિન-રિફંડપાત્ર) અરજીપત્ર સાથે ચુકવણી કરવાની રહેશે.

બેંકનું નામ

ઇન્સ્ટ્રુમેન્ટ નં. / UTR નં.

તારીખ

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો (ECLFL / ERFL)

SME લોન માટેની તમારી અરજી બદલ આભાર. ECL ફાઇનાન્સ લિમિટેડ (ECLFL/કંપની)/એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ (ERFL/કંપની) તમને ઉત્પાદન સુવિધાઓ વિશે સ્પષ્ટતા છે તેની ખાતરી કરવા માટે, કૃપા કરીને નીચેનામાંથી પસાર થવા અને તેની સ્વીકૃતિ પર સહી કરવા વિનંતી કરે છે. કૃપા કરીને તમારા ભાવિ સંદર્ભ માટે સ્વીકૃતિની કોપિ જાળવી રાખો. ECLFL /ERFL તેના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને તમારી જાણ હેઠળ, સંભવિત રૂપે ફી અને શુલ્કમાં ફેરફાર અથવા ફેરફાર કરવાના હકદાર રહેશે અને આવા તમામ સુધારા અથવા ફેરફારો તમારા પર અસરકારક અને બંધનકર્તા માનવામાં આવશે. કૃપા કરીને અમારી વેબસાઇટ https://ecfifinance.edelweissfin.com/?page_id=553 / <https://www.edelweissretailfin.com/fees-and-charges> પર અપડેટ કરેલી વિક ecfifinance.edelweissfin.com/ / www.edelweissretailfin.com ને અનુસરીને નવીનતમ ફી અને શુલ્ક માટેના શુલ્કની સૂચિનો સંદર્ભ લો. વધુમાં, તમે ECL ફાઇનાન્સ લિમિટેડ (ECLFL/કંપની)/એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ (ERFL/કંપની)ની કોઈપણ શાખામાં અથવા ECLFL/ERFL ની ગ્રાહક સેવા સાથે પૂછપરછ કરી શકો છો. લોન સુવિધા પર લાગુ વ્યાજ દર વિતરણની તારીખ(ઓ) પર પ્રવર્તમાન હશે અને તે બંને ધિરાણકર્તાઓના ગ્રાહકના મૂલ્યાંકન જેમ કે વ્યાવસાયિક લાયકાત, ધિરાણપાત્રતા, જોખમ પ્રોફાઇલ, સુરક્ષા, ફરી ચુકવણી ટ્રેક રેકૉર્ડ, બાહ્ય રેટિંગ્સ વગેરે પર આધારિત હશે. કંપની દ્વારા અપનાવવામાં આવેલા વ્યાજ દર મોડેલના આધારે, ઉપરોક્ત પરિબલોના આધારે તે જ ઉત્પાદન અને મુદત માટેના વ્યાજ દર જુદા જુદા ગ્રાહકો માટે અલગ અલગ હોઈ શકે છે. તમારી લોન પર લાગુ પ્રોસેસિંગ ફી અમારી વેબસાઇટ ecfifinance.edelweissfin.com / www.edelweissretailfin.com પર અપડેટ કરેલા શુલ્કની વિગતવાર સૂચિ છે. સિક્યોર્ડ લોન અરજીઓ માટે રૂ. 15000/- સુધીની એપ્લિકેશન ફી + GST લેવામાં આવશે. આ એપ્લિકેશન ફી અન્ય કોઈપણ ફીથી અલગ છે અને તે બિન-રિફંડપાત્ર છે અને અન્ય કોઈપણ ફી અથવા શુલ્ક સામે એડજસ્ટ કરી શકાતી નથી. એપ્લિકેશન ફી ફક્ત અરજદારના ખાતામાંથી ડિજિટલ અથવા વિડ ચેક દ્વારા ચૂકવવાની રહેશે. કોઈ એપ્લિકેશન ફી રોકડ અથવા કોઈપણ તૃતીય પક્ષ ખાતા દ્વારા ચૂકવવાની રહેશે નહીં. જો ગ્રાહક પાસેથી લોન ઉપાડની વિનંતીને કારણે લોન રદ કરવામાં આવે તો લોનના વિતરણ પહેલાં અથવા તે દરમિયાન એકત્રિત કરવામાં આવતી પ્રોસેસિંગ ફી, જો કોઈ હોય તો, પરતપાત્ર નથી. લોનલેનારને ECLFL/ERFLની તરફેણમાં ECLFL/ERFLની જરૂરિયાત મુજબની વીમા પોલિસીની સોંપણી કરવાની રહેશે, જો તે ECLFL/ERFLની ફરજિયાત જરૂરિયાત હોય અને શરતને આધિન હોય અને શરત કે વીમા પોલિસીની આવી સોંપણીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને મંજૂરીના દસ્તાવેજો અને/અથવા મંજૂરીના નિયમો અને શરતો અનુસાર લોનની રકમનું વિતરણ કરવા માટે અગાઉની શરત તરીકે સંમતિ થઈ હોય.

આ પત્ર સ્વીકારીને, તમે ,.....(ઉધાર લેનારનું નામ) પુષ્ટિ કરો છો કે તમે ઉપરોક્ત મુજબ MATC ની સામગ્રીઓ વાંચી અને સમજી છે. તમે એ પણ પુષ્ટિ કરો છો કે તમને કોઈ પણ ભેટ/ડિસ્કાઉન્ટ અથવા અન્ય કોઈ પણ વચનબદ્ધતા કે જેનું ઉપર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું ન હોય અથવા અન્ય કોઈ દસ્તાવેજનું વચન આપવામાં આવ્યું નથી. આગળ, તમે પુષ્ટિ કરો છો કે લોન સંદર્ભે તમારી પાસેથી કોઈ રોકડ એકત્રિત કરવામાં આવી નથી. તમે ECLFL/ ERFL ને CIBIL / અન્ય ક્રેડિટ બ્યુરોમાંથી તમારો ક્રેડિટ ઇતિહાસ કાઢવા માટે અધિકૃત કરો છો.

સૂચક વ્યાજનો દર:

સૂચક વ્યાજનો દર	SME અસુરક્ષિત વ્યવસાય લોન:	18% – 28%
	SME સુરક્ષિત લોન:	11% – 16%
	SME મિડ-માર્કેટ સપ્લાય ચેઇન ફાઇનાન્સ:	11% –17%
	SME અસુરક્ષિત નાની ATS લોન::	30% – 38%

નોંધ: ગ્રાહક માટે જોખમ ગ્રેડ લાગુ કરવામાં આવતા ઉત્પાદનના પ્રકાર, પૂરી પાડવામાં આવેલ કોલેટરલની પ્રકૃતિ, વ્યવસાયની પ્રકૃતિ/વિન્ટેજ, તેની કામગીરી, દેવું, બ્યુરો ટ્રેક અને અન્ડરરાઇટિંગ માટે શેર કરેલી માહિતી પર આધારિત છે.

ધોષણા (ECLFL / ERFL)

હું/અમે આથી પ્રમાણિત/અધિકૃત કરીએ છીએ: (એ) કે મારા/અમારા દ્વારા આપવામાં આવેલી બધી માહિતી સાચી અને સંપૂર્ણ છે; કે અરજીમાં જણાવ્યા સિવાય મારી/અમારી/પ્રમોટર્સ સામે કોઈ નિયત લેણાં/વૈધાનિક લેણાં નથી; (બી) હું પુષ્ટિ કરું છું કે ECLFL/ERFL પાસેથી મેળવેલ સવલતો સંબંધિત અરજી ફોર્મ/સંબંધિત દસ્તાવેજોમાં મારા/અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી કોઈપણ પૂર્વ સૂચના વિના અન્ય શાખાઓ, ક્રેડિટ બ્યુરો, સેવા પ્રદાતાઓ, બેંકો/નાણાકીય સંસ્થાઓ, સરકાર/નિયમનકારી સત્તાવાળાઓ અથવા તૃતીય પક્ષોને KYC માહિતી યકાસણી, ધિરાણ જોખમ વિશ્લેષણ અથવા ECLFL/ERFL યોગ્ય લાગે તેમ અન્ય સંબંધિત હેતુઓ માટે માહિતી જાહેર કરવાની સંમતિ આપું છું; (સી) મને કોઈ પણ બેંક/FIs દ્વારા ડિફોલ્ટર/વિલુપ્ત ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યો નથી અને કોઈ પણ બેંક/FIs દ્વારા મારી સામે બાકી નીકળતી રકમ કે નાણાંની વસૂલાત માટે કોઈ કાનૂની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે ફોજદારી કાર્યવાહી કે દાવો કરવામાં આવ્યો નથી; (ડી) તમારા સેવા પ્રદાતાઓ સહિત તમારા ગ્રુપની કોઈ પણ સંસ્થાને વ્યક્તિગત માહિતીની આપ-લે કરવા માટે, જે તમારા સેવા પ્રદાતાઓ દ્વારા આઉટસોર્સ કરેલ કાર્ય કરે છે, જેથી તેઓ આંતરિક વ્યાપાર પ્રક્રિયાઓ (જે વ્યવહારોને સરળ બનાવે છે) જેમ કે જોખમ વ્યવસ્થાપન હેતુઓ, ડેટા વિશ્લેષણ, ઓડિટ, વિકાસ અને સુધારણા, નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ કરવા માટે સક્ષમ બનાવી શકાય. હું/અમે મારી/અમારી અરજીના અનુસંધાનમાં જરૂરી હોય તેવી અન્ય તમામ માહિતી પ્રસ્તુત કરીશું કે આની આપ-લે તમને યોગ્ય લાગતી હોય તેવી કોઈ પણ એજન્સી સાથે પણ તમે કરી શકો છો અને તમે, તમારા પ્રતિનિધિઓ અથવા રિઝર્વ બેંક ઇન્ડિયા અથવા અન્ય કોઈ પણ સરકારી/નિયમનકારી સત્તાવાળાઓ/એજન્સી કે જેમને તમે અધિકૃત કર્યા હોય અને કોઈ પણ સમયે, ઉપર જણાવ્યા મુજબ અમારી ફેક્ટરી/બિઝનેસ સંકુલમાં લોનની અરજી વગેરેને ધ્યાનમાં લેવા માટે જરૂરી હોય તેવી અન્ય માહિતી અને ખાતાના મારા/અમારા મૂલ્યાંકનનું નિરીક્ષણ/ચકાસણી કરો; તમે બેંક/અમારી બાકી નીકળતી રકમની વસૂલાત માટે યોગ્ય સલામતી/પગલાં લઈ શકો છો, જેમાં ડિફોલ્ટર્સનું નામ વેબસાઇટમાં પ્રકાશન/RBIને સુપરત કરવાનો સમાવેશ થાય છે. વધુમાં સંમત છું કે મારી/અમારી લોનનું સંચાલન તમારી બેંક/અમારા નિયમો દ્વારા થશે, જે સમયાંતરે અમલમાં હોઈ શકે છે.

હું/અમે આથી પુષ્ટિ કરીએ છીએ કે સંપર્ક વિગતો જેમ કે અમારા દ્વારા પ્રદાન કરાયેલ ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર યોગ્ય છે. અમે ધિરાણકર્તા (ECLFL/ERFL) તરફથી મોબાઇલ નંબર પર SMS અથવા WhatsApp દ્વારા અથવા પૂરા પાડવામાં આવેલ ઇમેઇલ સરનામાં પર અથવા કોઈપણ સામાજિક પ્લેટફોર્મ દ્વારા કોઈપણ સંદેશાવ્યવહાર પ્રાપ્ત કરવા માટે સ્વીકારીએ છીએ અને સંમત છીએ.

હું/અમે આથી જાહેર કરીએ છીએ કે અમે પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) ના ધોરણોનું પાલન કરીએ છીએ અને અમે ESG નું પાલન કરવાનું યાવુ રાખીએ છીએ તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હું/અમે દસ્તાવેજ ચેકવિસ્ટની રસીદ સ્વીકારીએ છીએ અને ECLFL/ERFL પાસેથી લોન માટે ઉપર આપેલા નિયમો અને શરતો વાંચી અને સમજી છે.

હું/અમે આથી મારી ઓળખ/ સરનામું સ્થાપિત કરવાના હેતુથી CKYC રજિસ્ટ્રીમાંથી રેકૉર્ડ્સ ડાઉનલોડ કરવાની સંમતિ પ્રદાન કરીએ છીએ.

લાગુ કાયદાઓને આધીન અને અહીંથી ECLFL/ERFL અથવા તેના કોઈપણ આનુષંગિકો (શાખાઓ સહિત) (સામૂહિક રીતે ECLFL) ને કોઈપણ અધિકારક્ષેત્રમાં અમારી કર જવાબદારી સ્થાપિત કરવા માટે જરૂરી હોય ત્યાં સ્થાનિક અથવા વિદેશી નિયમનકારો અથવા કર સત્તાવાળાઓ સાથે મારી માહિતી શેર કરવા માટે સંમતિ આપીએ છીએ. જ્યાં સ્થાનિક અથવા વિદેશી નિયમનકારો અથવા કર સત્તાવાળાઓ દ્વારા જરૂરી હોય ત્યાં, અમે સંમતિ આપીએ છીએ કે ECLFL લાગુ કાયદાઓ, નિયમો અને નિર્દેશો અનુસાર જરૂરી હોય તે મુજબ કોઈપણ રકમ(ઓ)/સુરક્ષાને રોકી શકે છે.

આ સાથે હું મારી પોતાની મુનસફી મુજબ સ્વેચ્છાએ કોઈ પણ KYC દસ્તાવેજ, બેંકિંગ, નાણાકીય દસ્તાવેજો, સ્વ-પ્રમાણિત આધાર કાર્ડ/ભૌતિક ઇ-આધાર/માસ્ક કરેલ આધાર, UIDAI દ્વારા જારી કરાયેલા ઓફલાઇન ઇલેક્ટ્રોનિક આધાર અથવા માયગા મુજબના અન્ય દસ્તાવેજોની ભૌતિક કોપિ મારી પોતાની મુનસફી પ્રમાણે સ્વેચ્છાએ કંપની સમક્ષ મારી ઓળખ/સરનામાના પૂરાવા સ્થાપિત કરવા અને લોનની લાયકાતની ચકાસણીની પ્રક્રિયા કરવાના હેતુસર સુપરત કરવા સંમત થાઉં છું. મેં કંપની સાથે શેર કરવામાં આવી રહેલ આધાર કોપિ પર મારો આધાર નંબર રિડકટ (દૂર કર્યો)/બ્લેક આઉટ કર્યો છે. આધાર સંમતિ અને આધાર એકત્રિત કરવાનો હેતુ મને/અમને લાગુ પડતી અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં સમજાવવામાં આવ્યો છે. કંપનીએ મને/અમને જાણ કરી છે કે આ સંમતિ મારી લોન અરજી સાથે સંગ્રહિત કરવામાં આવશે.

હું/અમે આથી જાહેર કરીએ છીએ કે મારા/અમારા દ્વારા સ્વેચ્છાએ આપવામાં આવેલી બધી માહિતી સાચી અને સંપૂર્ણ છે. મારા દ્વારા પૂરી પાડવામાં આવેલી કોઈપણ ખોટી માહિતીના કિસ્સામાં હું/અમે ECLFL અથવા તેના કોઈપણ અધિકારીઓને જવાબદાર ઠેરવીશું નહીં. જો અમે ECLFL ને પ્રદાન કરેલી કોઈપણ માહિતીમાં કોઈ ફેરફાર થયો હોય તો હું/અમે 30 કેલેન્ડર દિવસની અંદર ECLFL ને સૂચિત કરવાનું વચન આપીએ છીએ.

અરજદારની સહી:_____સહ-અરજદાર 1ની સહી:_____સહ-અરજદાર 2ની સહી:_____

માત્ર ઓફિસ ઉપયોગ માટે

શાખાનું નામ		સહયોગી કોડ		તારીખ	
તારીખ		સહયોગીનું નામ		સ્થળ	_____

#ઉપર સંબંધિત વધુ વિગતો માટે કૃપા કરીને નીચે લાગુ એન્ટિટી વેબસાઇટ પર તમારી ગ્રાહક દસ્તાવેજીકરણ ચેકવિસ્ટ જાણો-

ECL ફાઇનાન્સ લિમિટેડ: www.ecfifinance.edelweissfin.com • એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ: www.edelweissretailfin.com



હકની લોન અરજીની સ્વીકૃતિ

SME ધિરાણ

ECL ફાઇનાન્સ લિમિટેડ (ECLFL) / એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ (ERFL)

ટાવર ૩, વિંગ 'બી', કોહિનૂર સિટી મોલ, કોહિનૂર સિટી, કિરોલ રોડ, ફુર્લા (પશ્ચિમ), મુંબઈ - 400 070 ટોલ ફ્રી નંબર 1-800-1026372 (સોમવાર - શુક્ર | સવારે 10 થી

ECL ફાઇનાન્સ લિમિટેડ ☐ એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ ☐ અરજીનો નંબર: _____

અમે ECL ફાઇનાન્સ લિમિટેડ / એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી લોન માટે તમારી અરજીની રસીદ સ્વીકારીએ છીએ. કૃપા કરીને તમારા પ્રશ્નો અને સૂચનો માટે આપેલ ઇમેલ ID પર અમને લખો.

1. રૂ. 15000/- સુધીની અરજી ફી + GST (પ્રકૃતિમાં બિન-રિફંડપાત્ર) સિક્યોર્ડ લોન અરજીઓ માટે અરજી ફોર્મ સાથે ચૂકવવાની રહેશે.

અરજદારનું નામ _____ લોનની રકમ લાગુ _____

સેલ્સ એકિઝક્યુટિવનું નામ અને મોબાઇલ નંબર _____ તારીખ _____

નોંધ: ECL ફાઇનાન્સ લિમિટેડ / એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કેડિટ મૂલ્યાંકન. લોન અરજીની સ્થિતિ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રાપ્ત કર્યાના 21 કામકાજના દિવસોમાં જાણવામાં આવશે અને અરજદારની કેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવાના હેતુસર નાણાકીય સંસ્થાને જરૂરી હોય તેવી કોઈપણ વધારાની માહિતી અરજદાર પ્રદાન કરશે. કૃપા કરીને અમારી રજિસ્ટર્ડ ઓફિસમાં અમારો સંપર્ક કરો અથવા તમારી અરજીની સ્થિતિ જાણવા માટે assistance@ecf.com પર અમને લખો. ફી અને શુલ્ક અને નિયમો અને શરતો અમારી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે: www.ecffinance.edelweissfin.com / www.edelweissretailfin.com

જરૂરી દસ્તાવેજો

- સહી કરેલ અરજી ફોર્મ
- રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પાર્ટનરશિપ ડીડ
- ઓળખ અને સરનામાના પુરાવાની કોપિ (સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ એટલે કે આધાર, પાસપોર્ટ, DL, NPR પત્ર, NREGA કાર્ડ, મતદાર ID કાર્ડ) અને અન્ય માનવામાં આવેલ OVDs કંપનીની KYC અને AML નીતિમાં ઉલ્લેખિત સરનામાના પુરાવા તરીકે
- બોર્ડ ઓફ ડિરેક્ટરનો ઠરાવ
- કંપનીની KYC અને AML નીતિ મુજબ વ્યવસાય પુરાવો
- COI અને મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન

- બિઝનેસ લોન માટે છેલ્લા 2 વર્ષનું ઓડિટ કરેલું નાણાકીય અને આવકવેરા રિટર્ન.
- SME સિક્યોર્ડ લોન અને મશીનરી લોન માટે છેલ્લા 3 વર્ષનું ઓડિટ કરેલું નાણાકીય અને આવકવેરા રિટર્ન.
- મેનેજરો, ભાગીદારો, અધિકારીઓ અથવા કર્મચારીઓને કંપની/ફર્મ વતી વ્યવસાયનો વ્યવહાર કરવા માટે પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે.
- છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ
- PANના બદલે PAN અથવા ફોર્મ 60.
- બેલેન્સ ટ્રાન્ઝફર સંબંધિત વહેવારોના કિસ્સામાં, જેની પાસેથી ધીરાણનું હસ્તાંતર કરાયું છે તે પ્રવર્તમાન ધીરાણ આપતી સંસ્થા પાસેથી મિલકત સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે ECL ફાઇનાન્સ લિમિટેડને/ એડલવાઇસ રિટેલ ફાઇનાન્સ લિમિટેડને ધીરાણ લેનારે ECL ફાઇનાન્સ લિમિટેડની તરફેણમાં પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) જરૂર પડશે.

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

ECLFL / ERFL તેના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને તમારી જાણ હેઠળ, www.ecdfinance.edelweissfin.com / www.edelweissretailfin.com પર વિગતવાર જણાવ્યા મુજબ સંભવિત રૂપે ફી અને શુલ્કમાં ફેરફાર અથવા ફેરફાર કરવાના હકદાર રહેશે અને આવા તમામ સુધારા અથવા ફેરફારો તમારા પર અસરકારક અને બંધનકર્તા માનવામાં આવશે. ફી અને ચાર્જ સંબંધિત કર, શિક્ષણ ઉપકર અને અન્ય સરકારી કર, વસૂલાત વગેરેને બાકાત રાખે છે. લોન સુવિધા પર લાગુ વ્યાજ દર વિતરણની તારીખ(ઓ) પર પ્રવર્તમાન હશે અને તે બંને કંપનીના ગ્રાહકના મૂલ્યાંકન જેમ કે વ્યાવસાયિક લાયકાત, ધિરાણપાત્રતા, જોખમ પ્રોફાઇલ, સુરક્ષા, ફરી ચુકવણી ટ્રેક રેકૉર્ડ, બાહ્ય રેટિંગ્સ વગેરે પર આધારિત હશે. કંપની દ્વારા અપનાવવામાં આવેલા વ્યાજ દર મોડેલના આધારે, ઉપરોક્ત પરિબલોના આધારે તે જ ઉત્પાદન અને મુદત માટેના વ્યાજ દર જુદા જુદા ગ્રાહકો માટે અલગ અલગ હોઈ શકે છે.

Vernacular Declaration

ENGLISH

Annexure III

Vernacular Declaration Form

I, _____ aged _____ years, son/daughter/spouse of _____ residing at _____

(address) do hereby solemnly affirm and declare as under:
I have been read out and explained the contents of all the loan documents and all other Transaction documents incidental to availing the loan of an amount of _____ from ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (Lender) by me in the _____ language known to me, and
I hereby affirm, confirm and declare that I have affixed my signature on the Loan Documents in the vernacular language after understanding the terms and conditions of all the Loan Documents and its implications on my interests and I do hereby agree to abide by all the terms and conditions of the loan and the clauses of the same.
I further confirm and declare that I have executed this declaration without any undue influence, coercion, misrepresentation or fraud and I have given this affidavit with my free consent and will.

Signature/Thumb impression of Applicant/co-applicant signing in Vernacular Language _____
Date: _____
Place: _____
Name: Mr./Ms. _____ [the Declarant (Branch/Relationship Manager/Official of the Lender)]
Signature of the Official of the Lender: _____
Note:
1. This declaration is required to be taken where Borrower does not understand English and the documents are in English.
2. This is a declaration form & is not required to be executed on Stamp Paper nor to be notarised

HINDI

परिशिष्ट III

स्थानीय भाषा घोषणा प्रपत्र

मैं, _____, आयु _____ वर्ष, पुत्र/पुत्री/पति/पत्नी _____, _____ (पता) का निवासी हूँ _____, मैं एतद्वारा सत्यनिष्ठा से प्रतिज्ञान करता/ती हूँ और घोषणा करता/ती हूँ कि:
मुझे ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (ऋणदाता) से _____ राशि का ऋण प्राप्त करने से संबंधित सभी ऋण दस्तावेजों और अन्य सभी लेन-देन के दस्तावेजों की अंतर्वस्तु को मेरी स्थानीय भाषा _____ में पढ़कर सुना दिया गया है, तथा
मैं एतद्वारा प्रतिज्ञान, पुष्टि और घोषणा करता/ती हूँ कि मैंने सभी ऋण दस्तावेजों की शर्तों और मेरे हितों पर पड़ने वाले इसके प्रभावों को स्थानीय भाषा में अच्छी तरह से समझने के बाद ऋण दस्तावेजों पर अपने हस्ताक्षर किए हैं तथा मैं ऋण के सभी नियमों व शर्तों और उसके उपबंधों का पालन करने के लिए सहमत हूँ।
मैं आगे पुष्टि और घोषणा करता/ती हूँ कि मैंने बिना किसी अनुचित प्रभाव, दबाव, गलत बयानी या धोखाधड़ी के इस घोषणा का निष्पादन किया है और मैंने यह शपथ पत्र अपनी स्वतंत्र सहमति और स्वेच्छा से दिया है।

MARATHI

परिशिष्ट III

स्थानिकभाषा घोषणा फॉर्म

मी, _____ वय _____ वर्ष, मुलगा/मुलगी/पती/पत्नी _____ निवासी _____ (पता) खालीलप्रमाणे गांभीर्यने पुष्टी आणि घोषणा करत आहे:
ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (कर्जदार) कडून _____ रकमेचे कर्ज घेण्यासंदर्भातील सर्व कर्जाची कागदपत्रे आणि इतर सर्व व्यवहार दस्तऐवजांचा मजकूर मला माहित असलेल्या _____ भाषेत मला वाचून दाखविला गेला आहे आणि समजावून सांगितला आहे आणि
सर्व कर्ज दस्तऐवजांच्या अटी व शर्ती आणि त्याचा माझ्या हितसंबंधावर होणारा परिणाम समजून घेतल्यानंतर मी स्थानिक भाषेत कर्जाच्या कागदपत्रांवर माझी स्वाक्षरी केलीआहे याची मी पुष्टी, खात्री आणि घोषणा करतो आणि मी कर्जाच्या सर्व अटी व शर्ती आणि त्यातील कलमांचे पालन करण्यास सहमत आहे.
मी कोणत्याही अनुचित प्रभावाशिवाय, बळजबरीने, चुकीची माहिती न देता किंवा फसवणुकीशिवाय या घोषणेची अंमलबजावणी केली आहे आणि मी माझ्या मुक्त संमतीने आणि इच्छेने हे प्रतिज्ञापत्र दिले आहे.

स्थानिक भाषेत स्वाक्षरी करणाऱ्या अर्जदाराची/सह-अर्जदाराची स्वाक्षरी/अंगठ्याचा ठसा _____
तारीख: _____
ठिकाण: _____
नाव: श्री./सौ.. _____ [घोषणाकर्ता (शाखा/नसहसंबंध व्यवस्थापक/धनकोचे अधिकारी)]
कर्जदाराच्या अधिकाऱ्याची स्वाक्षरी: _____

नोंद:
1. ज्या ठिकाणी कर्जदाराला इंग्रजी समजत नाही आणि कागदपत्रे इंग्रजीत आहेत तेथे ही घोषणा घेणे आवश्यक आहे.
2. हा एक घोषणा फॉर्म आहे आणि स्टॅम्प पेपरवर अंमलात आणण्याची आवश्यकता नाही किंवा नोटरीकृत करण्याची आवश्यकता नाही

જાહેરાતનું પત્રક માતૃભાષામાં

મારું નામ _____ છે, મારી વય _____ વર્ષ છે, હું _____ નો પુત્ર/પુત્રી/જીવનસાથી છું. મારું સરનામું _____ છે. હું આથી ગંભીરતાપૂર્વક દૃઢપણે એકરાર કરું છું અને નીચે મુજબ જાહેરાત કરું છું:

ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (ધીરાણ આપનારે) _____ ની રકમનું ધીરાણ મેળવવા સંબંધિત તમામ ધીરાણના દસ્તાવેજોના લખાણ અને વહેવાર સંબંધિત અન્ય તમામ દસ્તાવેજોના લખાણ મને _____ ભાષામાં વાંચી સંભળાવ્યા અને સમજાવ્યા છે.

હું આથી ખાતરી આપું છું, સમર્થન આપું છું અને જાહેર કરું છું કે મેં તમામ ધીરાણના દસ્તાવેજોના નિયમો અને શરતો અને મારા હિતો ઉપર થતી તેની અસરો સ્થાનિક ભાષામાં સમજ્યા પછી ધીરાણના દસ્તાવેજો ઉપર મારી સહી કરી છે અને હું આથી ધીરાણની તમામ શરતોનું અને તેની કલમોનું પાલન કરવા માટે સંમત થઉં છું.

હું વધુમાં હું સમર્થન આપું છું અને જાહેર કરું છું કે મેં આ જાહેરાત ક્રોઇપણ અનુચિત પ્રભાવ, જબરદસ્તી, ખોટી રજૂઆત અથવા છેતરપિંડી વગર કરી છે અને મેં મારી સ્વૈચ્છિક સંમતિ અને ઇચ્છાથી આ સોગંદનામું આપ્યું છે.

સ્થાનિક ભાષામાં સહી કરનાર અરજદાર/સહ-અરજદારની સહી/અંગૂઠાની છાપ _____

તારીખ: _____

સ્થાન: _____

નામ: શ્રી/સુશ્રી _____ (જાહેરાત કરનાર (શાખા/રિલેશનશિપ મેનેજર/ધીરાણ આપનાર અધિકારી))

ધીરાણ આપનાર અધિકારીની સહી : _____

નોંધ:

- ધીરાણ લેનાર અંગ્રેજી સમજી ન શકતા હોય અને દસ્તાવેજો અંગ્રેજીમાં હોય ત્યારે આ જાહેરાત લેવી જરૂરી છે.
- આ એક જાહેરાત પત્રક છે અને તેનો અમલ સ્ટેમ્પ પેપર ઉપર કરવાની કે તે નોટરાઇઝડ કરવાની જરૂર નથી.

આঞ্চલિક ભાષાય લિખિત ઘોષણાપત્ર

આમિ, _____ વયસ _____ বছર, _____ એર _____ પુત્ર/કન્યા/પત્ની _____ નિવાસ _____ (ઠિકાના) એતદ્વારા દૃઢભાવે નિચે પ્રદત્ત વચ્ચન નિશ્ચિત કરહિ એવં ઘોષણા કરહિ:

ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (શ્ચાળદાતા) થેકે _____ પરિમાણ અર્થ શ્ચાળ પાગ્યાર જન્ય સમસ્ત શ્ચાળ સંગ્રાસ્ત નથિ એવં અન્યન્ય સમસ્ત લેનદેનેર નથિર વિષયવસ્તુ આમાર જાના _____ ભાષાય આમાકે પડે શોનાનો હયેછે એવં સેગુલિ બ્યાખ્યા કરા હયેછે, એવં

આમિ એતદ્વારા સ્વીકાર કરહિ, નિશ્ચિત કરહિ એવં ઘોષણા કરહિ યે આમિ સ્થાનીય ભાષાય શ્ચાળ સંગ્રાસ્ત યાવતીય નથિર શર્તાવલી એવં આમાર સ્થાર્થેર ઉપર સેગુલિર પ્રભાવ બોબાર પરે શ્ચાળેર નથિતે નિજેર સ્થાસ્કર પ્રદાન કરેહિ એવં આમિ એતદ્વારા શ્ચાળ સંગ્રાસ્ત સમસ્ત નિયમ ં શર્તાવલી એવં ધારા મેને ચલતે સમ્મતિ પ્રદાન કરહિ।

આમિ આરંબ નિશ્ચિત કરહિ એવં ઘોષણા કરહિ યે આમિ એઈ છુક્તિટિ કોનો અચાચિત પ્રભાવ, જવરદસ્તિ, ભૂલ ઉપસ્થાપના વા જાલિયાતિ હાડાઈ કાર્યકર કરેહિ એવં આમિ આમાર વ્યક્તિગત સમ્મતિ એવં ઇચ્છાય એઈ હલ્ફનામા પ્રદાન કરેહિ।

આঞ্চલિક ભાષાય સ્થાસ્કરકારી આવેદનકારી/સહ-આવેદનકારીર સ્થાસ્કર/આંબુલેર હાપ _____

તારિથ: _____

સ્થાન: _____

નામ: શ્રી/શ્રીમતિ _____ [ઘોષણાકારી (શાખા/રિલેશનશિપ મ્યાનેજાર / શ્ચાળદાતાર પક્ષે કર્મકર્તા)]

શ્ચાળદાતાર કર્મકર્તાર સ્થાસ્કર: _____

નોંટ:

- એઈ ઘોષણાટિ સેઈ ક્ષેત્રે નેગ્યા પ્રયોજન યેથાને શ્ચાળગ્રંથીતા ઇંગ્રેજિ બોબેન ના એવં યાવતીય નથિ ઇંગ્રેજિતે રયેછે।
- એટિ કેવલ એકટિ ઘોષણાપત્ર એવં એટિ સ્ટેમ્પ પેપારે કાર્યકર કરા વા નોટારિ કરાર પ્રયોજન નેઈ।

ଆଞ୍ଚଳିକ ଭାଷାରେ ଘୋଷଣାକାମା ଫର୍ମ

ମୁଁ, _____ ବୟସ _____ ବର୍ଷ, _____ କର ପୁତ୍ର/କନ୍ୟା/ଜୀବନସାଥୀ ବାସିନୀ _____

(ଠିକଣା) ଏତଦ୍ୱାରା ନିମ୍ନରେ ଦିଆଯାଇଥିବା ଅନୁଯାୟୀ ସୁନିଶ୍ଚିତ କରୁଛି ଏବଂ ଘୋଷଣା କରୁଛି:

ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (ରଣଦାତା) କଠାରୁ _____ ପରିମାଣର ଏକ ରଣ ନେବା ପାଇଁ ସମସ୍ତ ରଣ ଦଲିଲର ବିଷୟବସ୍ତୁ ଏବଂ ଏହି ରଣ ନେବା ସମ୍ପର୍କିତ ଅନ୍ୟ ସମସ୍ତ କାରବାର ଦଲିଲ୍ ମୁଁ ଜାଣିଥିବା ଭାଷାରେ _____ ମୋତେ ପଢ଼ି ଶୁଣାଇ ଦିଆଯାଇଛି ଏବଂ ବୁଝାଇ ଦିଆଯାଇଛି ଏବଂ

ମୁଁ ଏତଦ୍ୱାରା ସ୍ୱୀକାର କରୁଛି, ସୁନିଶ୍ଚିତ କରୁଛି ଏବଂ ଘୋଷଣା କରୁଛି ଯେ ମୁଁ ସମସ୍ତ ରଣ ଦଲିଲର ସର୍ତ୍ତ ଓ ନିୟମାବଳି ଓ ମୋର ସ୍ୱାର୍ଥ ଉପରେ ଏହାର ପ୍ରଭାବ ବିଷୟରେ ବୁଝିବା ପରେ ଆଞ୍ଚଳିକ ଭାଷାରେ ଏହି ରଣ ଦଲିଲରେ ମୋର ସ୍ୱାକ୍ଷର କରିଛି ଏବଂ ମୁଁ ଏତଦ୍ୱାରା ସମ୍ମତ ହେଉଛି ଯେ ଏହି ରଣର ସମସ୍ତ ସର୍ତ୍ତ ଓ ନିୟମାବଳି ଓ ଏହାର ବିଧାନ ପାଳନ କରିବି।

ମୁଁ ଅତିରିକ୍ତ ଭାବରେ ସୁନିଶ୍ଚିତ କରୁଛି ଏବଂ ଘୋଷଣା କରୁଛି ଯେ କୌଣସି ଅଥବା ପ୍ରଭାବ, ବାଧ୍ୟବାଧକତା, ବୁଦ୍ଧିପୂର୍ଣ୍ଣ ଉପସ୍ଥାପନା କିମ୍ବା ଠକାମି ବ୍ୟତୀତ ମୁଁ ଏହି ଘୋଷଣାକାମା ସମ୍ପାଦିତ କରୁଛି ଏବଂ ମୁକ୍ତ ଇଚ୍ଛାରେ ଓ ସ୍ୱଇଚ୍ଛାରେ ଏହି ସତ୍ୟାର୍ପଣ ପ୍ରଦାନ କରିଛି।

ଜନାକୂଳାର୍ ଭାଷାରେ ଆବେଦନକାରୀ / ସହ-ଆବେଦନକାରୀଙ୍କ ଦସ୍ତଖତ / ଥମ୍ ଇମ୍ପ୍ରେସନ୍ _____

ତାରିଖ: _____

ସ୍ଥାନ: _____

ନାମ: ଶ୍ରୀଯୁକ୍ତ /ଶ୍ରୀମତୀ _____ [ଏହି ଘୋଷଣାକାରୀ (ଶାଖା/ସମ୍ପର୍କ ପ୍ରବନ୍ଧକ/ ରଣଦାତାଙ୍କର ଅଧିକାରୀ)]

ରଣଦାତାଙ୍କର କର୍ମକର୍ତ୍ତାଙ୍କର ସ୍ୱାକ୍ଷର: _____

ସୂଚନା:

- ଯେଉଁଠାରେ ରଣଗ୍ରହିତା ଇଂରାଜୀ ଭାଷା ବୁଝନ୍ତି ନାହିଁ ଏବଂ ଏହି ଦଲିଲଗୁଡ଼ିକ ଇଂରାଜୀରେ ରହିଥାଏ ଏହି ଘୋଷଣାକାମା ନିଆଯିବା ଆବଶ୍ୟକ ହୋଇଥାଏ।
- ଏହା ହେଉଛି ଏକ ଘୋଷଣାକାମା ଫର୍ମ ଏବଂ ଷ୍ଟାମ୍ପ ପେପରରେ ସମ୍ପାଦିତ କରାଯିବା କିମ୍ବା ନୋଟାରାଇଜ୍ କରାଯିବା ଆବଶ୍ୟକ ହୋଇନଥାଏ।

ప్రాదేశిక భాషా ఘోషణ నమూనె

నాను, _____, _____ వರ್ష _____ వయస్సినవనా/ళాగిద్దు, _____ అవర _____ మగ/మగళు/సంగాతి _____ ఈ క్ళగిన _____ (చీళాస) చీళాసదల్లి వాసినుత్తిద్దు ఈ చిషయవన్న ఆత్మసాక్షియాగి దృఢిశరసి ఘోషినుత్తిద్దేన:

ననగ్ తిళిద _____ భాషేయల్లి నాను ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (సాలదాతరు) నింద _____ మోత్తద సాలవన్న పడేయలు ప్రాసంగికవాద ఎల్లా సాలద దాఖలేగళన్ను మరియు ఎల్లా ఇతర వహివాటు దాఖలేగళ చిషయగళన్ను నాను ఓదిద్దేనె మరియు అర్ధమాడిశొందిద్దేనె మరియు

సాల దాఖలేగళ ఎల్లా కరారుగళు మరియు షరత్తుగళన్ను అర్ధమాడిశొండ నంతర నాను ప్రాదేశిక భాషేయల్లి సాలద దాఖలేగళ మేలే నన్న సహియన్ను శాకిద్దేనె ఎందు నాను ఈ మూలక దృఢిశరెసుత్తేనె, మరియు ఘోషినుత్తేనె మరియు నన్న హితాసత్తిగళ మేలే అదర పరిణామగళు మరియు సాలద ఎల్లా కరారుగళు మరియు షరత్తుగళు శాగూ అదర షరత్తుగళిగె బద్దనాగిరుత్తేనెందు నాను ఈ మూలక ఒప్పికొళ్ళుత్తేనె.

నాను ఈ ఘోషణేయన్ను యావుదే అనుజిత ప్రభావ, బలవంత, తప్ప నిరూపణే అథవా వంజనేయన్ను మాడడే కాయగతగొళిసిద్దేనె మరియు నన్న ముక్త సమ్మతి మరియు ఇట్టియొందిగె నాను ఈ అఫిడవిజ్ అన్న నీడిద్దేనె ఎందు నాను దృఢిశరెసుత్తేనె మరియు ఘోషినుత్తేనె.

అజిడారర/సశ అజిడారర సహి/హేబ్బరళిన గురుతు స్థళియ భాషేయల్లి సహి మాడువుదు _____

దినాంశ: _____

స్థళి: _____

హసరు: శ్రీ/శ్రీమతి _____ [ఘోషణే మాడిదవరు (శాఖి/సంబంధ వ్యవస్థాపకరు/సాలదాతర అధికారి)]

సాల నీడువవర అధికారియ సహి: _____

గమనిసి:

- సాలగారరిగె ఇంగ్లిష్ అర్ధవాగదిద్దల్లి మరియు దాఖలేగళు ఇంగ్లిష్‌నల్లిద్దరే ఈ ఘోషణేయన్ను తేగదుకొళ్ళబేకాగుత్తడే.
- ఇదు ఘోషణా నమూనె ఆగిడే మరియు స్క్యాంప్ షేషరన్‌ల్లి కాయగతగొళిసువ ఆగత్తచిల్ల అథవా నోటరీస్ మాడబేకాద ఆగత్తచిల్ల

TELUGU
 అనుబంధం III

వ్యవహారిక భాషలో ప్రకటన ఫారమ్ నేను, _____ వయసు _____ సంవత్సరాలు, _____ గారి కుమారుడు/కుమార్తె/భాగస్వామిగా, _____ (చిరునామా)లో నివసిస్తూ, క్రింది విధంగా విస్తృతంగా ధృవీకరిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను: ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (రుణదాత) నుండి _____ మొత్తం లోను పొందడానికి సంబంధించిన అన్ని లోన్ డాక్యుమెంట్లు మరియు అన్ని ఇతర లావాదేవీ పత్రాల్లోని విషయాలను నాకు తెలిసిన _____ భాషలో నేను చదువుకున్నాను, నాకు వాటి గురించి వివరించారు మరియు లోను పత్రాల్లోని నిబంధనలు మరియు షరతులు గురించి మరియు నా ఆసక్తుల మీద వాటి ప్రభావాలు గురించి నాకు అర్థమయ్యే భాషలో అర్థం చేసుకున్న తర్వాత, లోను పత్రాల మీద నా సంతకం చేశానని మరియు లోను సంబంధిత అన్ని షరతులు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండడానికి నేను అంగీకరిస్తున్నానని నేను ధృవీకరిస్తున్నాను మరియు నిర్ధారిస్తున్నాను. ఎలాంటి అనవసర ప్రభావం, బలవంతం, తప్పుడు ప్రాతినిధ్యం లేదా మోసం లేకుండా నేను ఈ ప్రకటన చేస్తున్నానని మరియు నా స్వేచ్ఛా సమ్మతి మరియు సంకల్పంతోనే ఈ అఫిడవిట్ అందించానని కూడా నేను ధృవీకరిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను.

మాతృభాషలో సంతకం చేసిన దరఖాస్తుదారు/సహ-దరఖాస్తుదారు యొక్క సంతకం/బొటనవేలు ముద్ర _____

తేదీ: _____

స్థలం: _____

పేరు: శ్రీ/శ్రీమతి _____ [ప్రకటనదారు (బ్రాంచ్/రిలేషన్‌షిప్ మేనేజర్/రుణదాతకు చెందిన అధికారి)]

రుణదాత యొక్క అధికారి సంతకం: _____

గమనిక:

- రుణగ్రహీతకు ఇంగ్లీషు అర్థం కానప్పుడు మరియు పత్రాలు ఆంగ్లంలో ఉన్నప్పుడు ఈ డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- ఇదొక డిక్లరేషన్ ఫారమ్ మరియు దీనిని ప్లాంట్ పేపర్ మీద అమలు చేయాల్సిన అవసరం లేదు లేదా నోటరీ చేయాల్సిన అవసరం లేదు.

TAMIL
 இணைப்பு III

வட்டார மொழி அறிவிப்புப் படிவம்

நான், _____ வயது _____ ஆண்டுகள், _____ மகன்/மகள்/மனைவி _____ வசிக்குமிடம் _____

_____ (முகவரி), இதன் மூலம் அடியில் கண்டவாறு உண்மையாக உறுதிசெய்து அறிவிக்கின்றேன்:

ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (கடன் வழங்குபவர்) நிறுவனத்திலிருந்து _____ கடனைப் பெறுவது தொடர்பான அனைத்து கடன் ஆவணங்கள் மற்றும் பிற அனைத்து பரிவர்த்தனை ஆவணங்களின் உள்ளடக்கங்களை எனக்கு தெரிந்த _____ மொழியில் நான் படித்தேன், அவைகள் குறித்து எனக்கு விளக்கப்பட்டன, மேலும்

அனைத்து கடன் ஆவணங்களின் விதிமுறைகள் மற்றும் நிபந்தனைகள் மற்றும் எனது விருப்பங்கள் மீதான அதன் தாக்கங்கள் ஆகியவற்றைப் புரிந்து கொண்ட பிறகு, வட்டார மொழியில் கடன் ஆவணங்களில் எனது கையொப்பத்தை பதித்துள்ளேன் என்பதையும், கடனின் அனைத்து விதிமுறைகள் மற்றும் நிபந்தனைகள் மற்றும் அதன் உட்பிரிவுகளுக்கு இணங்குவதற்கு நான் இதன்மூலம் ஒப்புக்கொள்கிறேன் என்பதையும் நான் இதன்மூலம் உறுதிமொழிகிறேன், உறுதிப்படுத்துகின்றேன் மற்றும் அறிவிக்கின்றேன்.

நான் ஏதேனும் தேவையற்ற தூண்டுதல், வற்புறுத்தல், தவறான விளக்கம் அல்லது மோசடி இல்லாமல் நான் இந்த அறிவிப்பை செயல்படுத்தியுள்ளேன் என்பதை மேலும் உறுதிப்படுத்தி அறிவிக்கிறேன், மேலும் எனது தன்னிச்சையான ஒப்புதல் மற்றும் விருப்பத்துடன் இந்த உறுதிமொழியை அளித்துள்ளேன்.

விண்ணப்பதாரர்/இணை விண்ணப்பதாரரின் கையொப்பம்/கட்டை விரல் பதிவு வடமொழி மொழியில் கையொப்பமிடுதல் _____

தேதி: _____

இடம்: _____

பெயர்: திரு./செல்வி. _____ [அறிவிப்பவர் (கிளை/உறவு மேலாளர்/ கடன் வழங்குபவரின் அலுவலர்)]

கடனாளியின் அதிகாரியின் கையொப்பம்: _____

குறிப்பு:

- கடன் வாங்குபவருக்கு ஆங்கிலம் புரியவில்லை மற்றும் ஆவணங்கள் ஆங்கிலத்தில் இருந்தால் இந்த அறிவிப்பு மேற்கொள்ளப்பட வேண்டும்.
- இது ஒரு அறிவிப்புப் படிவம் & இதை முத்திரைத் தாளில் செயல்படுத்தப்பட வேண்டிய அவசியமில்லை அல்லது நோட்டரி மூலம் சான்றளிக்க வேண்டிய அவசியமில்லை

MALYALAM
 അനുബന്ധം III

പ്രാദേശിക ഭാഷയിലുള്ള പ്രഖ്യാപന ഫോം _____ ല് (വിലാസം) താമസിക്കുന്ന _____ എന്നയാളുടെ മകന് / മകള് / പങ്കാളി ആയ _____ എന്ന ഞാന് _____ വയസ് ഇനി പറയും വിധം സൌരവം പ്രസ്താവിക്കുന്നു.

ഇസിഎൽ ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (കടം കൊടുക്കുന്നയാൾ) നിന്ന് _____ തുകയുടെ ലോൺ ലഭിക്കുന്നതിനായുള്ള എല്ലാ വായ്പ്പാ രേഖകളുടെയും, മറ്റെല്ലാ ഇടപാട് രേഖകളുടെയും ഉള്ളടക്കം എന്നിക്കു പൂർണ ഗ്രാഹിയുള്ളതായ _____ ഭാഷയിൽ വായിച്ച് വിശദീകരിച്ചു തന്നിട്ടുണ്ട്. എല്ലാ വായ്പ്പാ രേഖകളുടെയും നിബന്ധനകളും വ്യവസ്ഥകളും അവയുടെ താൽപ്പര്യങ്ങളും അതിന്റെ പ്രത്യാഘാതങ്ങളും മനസ്സിലാക്കിയതിന് ശേഷം പ്രാദേശിക ഭാഷയിലുള്ള വായ്പ്പാ രേഖകളിൽ ഞാൻ ഒപ്പിട്ടിട്ടുണ്ട് എന്ന് ഇതിനാൽ സ്ഥിരീകരിക്കുകയും പ്രഖ്യാപിക്കുകയും ചെയ്യുന്നു, കൂടാതെ വാങ്ങിയുടെ എല്ലാ നിബന്ധനകളും വ്യവസ്ഥകളും പാലിച്ചു കൊള്ളാമെന്ന് ഞാൻ ഇതിനാൽ സമ്മതിക്കുന്നു. അനാവശ്യമായ സ്വാധീനമോ ബലപ്രയോഗമോ തെറ്റായ വിവരണമോ വഞ്ചനയോ ഇല്ലാതെയാണ് ഞാൻ ഈ പ്രഖ്യാപനം നടപ്പാക്കിയതെന്നും എന്റെ സ്വതന്ത്ര സമ്മതത്തോടെയും ഇച്ഛാശക്തിയോടെയുമാണ് ഞാൻ ഈ സത്യവാങ്മൂലം നൽകിയതെന്നും ഞാൻ സ്ഥിരീകരിക്കുകയും പ്രഖ്യാപിക്കുകയും ചെയ്യുന്നു.

പ്രാദേശിക ഭാഷയിൽ ഒപ്പിടുന്ന അപേക്ഷകന്റെ / സഹ അപേക്ഷകന്റെ ഒപ്പ് / പെരുവിരലടയാളം _____ തീയതി: _____ സ്ഥലം: _____ പേര്: ശ്രീ/ശ്രീമതി. _____ [ഡിക്ലറന്റ് (ബ്രാഞ്ച്/റിലേഷൻഷിപ്പ് മാനേജർ/കടം കൊടുക്കുന്ന ഉദ്യോഗസ്ഥൻ)] വായ് നൽകുന്ന ഉദ്യോഗസ്ഥന്റെ ഒപ്പ്: _____ കുറിപ്പ്:

- കടം വാങ്ങുന്നയാൾക്ക് ഇംഗ്ലീഷ് മനസ്സിലാകാത്തതും രേഖകൾ ഇംഗ്ലീഷിലുള്ളതുമായിടത്ത് ഈ ഡിക്ലറേഷൻ എടുക്കേണ്ടതുണ്ട്.
- ഇത് ഒരു ഡിക്ലറേഷൻ ഫോമാണ്, ഇത് സ്റ്റാമ്പ് പേപ്പറിൽ മുദ്രണം ചെയ്യുകയോ നോട്ടറി ചെയ്യുകയോ ചെയ്യേണ്ടതില്ല

KONKANI

परिशिष्ट III

लोकभास घोशणापत्राचो फॉर्म
हांव, _____ पिरायेचो _____ वर्सा, _____ चो
पूत/धूव/जोदार _____ (पत्तो) हाचे वरवीं गंभीरतायेन पुष्टी आनी हांव सकयल दिल्ल्या प्रमाण
जाहीर करतां:

ECL Finance Limited/Edelweiss Rtail Finance Limited (रिणा दिवपी) कडल्यान _____ रक्कमेचें रीण मेळोवपा खातीर संबंदीत आशिल्ल्या सगळ्या रिणाच्या दस्तावेजांची आशय आनी हेर सगळ्या वेव्हार दस्तावेजांची आशय आनी सगळ्या रिणाच्या दस्तावेजांची नेम आनी अटी म्हाका वाचून _____ भाशेंत स्पश्ट केल्या, आनी ताचे म्हज्या हिताचेर परिणाम समजून घेतले उपरांत हांवें रिणाच्या कागदपत्रांचेर म्हजी स्वाक्षरी लोकभाशेंत केल्या अशें हांव हाचे वरवीं पुष्टी करतां आनी जाहीर करतां आनी हांव हाचे वरवीं रिणाच्यो सगळ्यो नेम, अटी आनी कलम पाळपाक मान्यताय दितां. हांव फुडें पुष्टी करतां आनी जाहीर करतां की हांवें ही घोशणा कसलोच अनुचित प्रभाव, जबरदस्ती, चुकीचें वर्णन वा फटवणूक करिनासतना चालीक लायल्या आनी हें प्रतिज्ञापत्र हांवें म्हज्या मुक्त संमती आनी इत्से प्रमाण दिलां.

अर्जदार/सह-अर्जदार लोकभाशेंत स्वाक्षरी करपाची स्वाक्षरी/आंगठो छाप _____ तारीख: _____ सुवात: _____ नांव: श्री/सुश्री _____ [घोषक (शाखा/संबंद वेवस्थापक/ऋण दिवप्याचो अधिकारी)]. नोंद:

- जंय रिणाकाराक इंग्लीश समजना आनी कागदपत्रां इंग्लीशींत आसात थंय ही घोशणा घेवपाची गरज आसा.
- हो घोशणापत्र फॉर्म आनी स्टॅम्प पेपराचेर कार्यान्वीत करपाची वा नोटरी करपाची गरज ना

PUNJABI

ਅਨੁਬੰਧ III

ਸਥਾਨਿਕ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਘੋਸ਼ਣਾ ਫਾਰਮ
ਮੈਂ, _____ ਉਮਰ _____ ਸਾਲ, ਪੁੱਤਰ / ਪੁੱਤਰੀ / ਪਤੀ / ਪਤਨੀ ਵਾਸੀ _____
_____ (ਪਤਾ) ਹੇਠ ਲਿਖੇ ਅਨੁਸਾਰ ਘੋਸ਼ਣਾ ਕਰਦਾ/ਦੀ ਹਾਂ:

ਮੈਂ ਸੱਭ ਕਰਜ਼ਾ ਦਸਤਾਵੇਜ਼ ਅਤੇ ਹੋਰ ਸਾਰੇ ਸੰਚਾਰ ਦਸਤਾਵੇਜ਼ ਦੇ ਤੱਥ ਜੋ ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (ਕਰਜ਼ਾਦਾਤਾ) ਤੋਂ _____ ਰਕਮ ਦੇ ਕਰਜ਼ੇ ਦਾ ਲਾਭ ਲੈਣ ਦੇ ਸਬੰਧ ਵਿੱਚ ਹਨ ਨੂੰ ਮੈਨੂੰ ਮੇਰੇ ਦੁਆਰਾ ਜਾਣੀ ਜਾਂਦੀ _____ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਮੇਰੇ ਦੁਆਰਾ ਮੇਰੀ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਪੜ੍ਹ ਲਿਆ ਹੈ ਅਤੇ ਮੈਨੂੰ ਸਮਝਾਇਆ ਗਿਆ ਹੈ, ਅਤੇ ਮੈਂ ਇਸ ਨਾਲ ਪੁਸ਼ਟੀ ਅਤੇ ਐਲਾਨ ਕਰਦਾ/ਦੀ ਹਾਂ ਕਿ ਮੈਂ ਸਾਰੇ ਕਰਜ਼ੇ ਦੇ ਦਸਤਾਵੇਜ਼ਾਂ ਦੇ ਨਿਯਮਾਂ ਅਤੇ ਸ਼ਰਤਾਂ ਅਤੇ ਮੇਰੇ ਹਿੱਤਾਂ 'ਤੇ ਇਸ ਦੇ ਪ੍ਰਭਾਵ ਨੂੰ ਸਮਝਣ ਤੋਂ ਬਾਅਦ ਮੇਰੀ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਕਰਜ਼ੇ ਦੇ ਦਸਤਾਵੇਜ਼ਾਂ 'ਤੇ ਆਪਣਾ ਦਸਤਖਤ ਕੀਤੇ ਹਨ ਅਤੇ ਮੈਂ ਇਸ ਲਿਖਤ ਰਾਹੀਂ ਸਾਰੇ ਨਿਯਮਾਂ ਅਤੇ ਸ਼ਰਤਾਂ ਦੀ ਪਾਲਣਾ ਕਰਨ ਲਈ ਸਹਿਮਤ ਹਾਂ। ਮੈਂ ਇਸ ਲਿਖਤ ਰਾਹੀਂ ਪੁਸ਼ਟੀ ਅਤੇ ਐਲਾਨ ਕਰਦਾ/ਦੀ ਹਾਂ ਕਿ ਮੈਂ ਇਸ ਘੋਸ਼ਣਾ ਨੂੰ ਬਿਨਾਂ ਕਿਸੇ ਅਣਉਚਿਤ ਪ੍ਰਭਾਵ, ਜ਼ਬਰਦਸਤੀ, ਗਲਤ ਜਾਣਕਾਰੀ ਜਾਂ ਧੋਖਾਧੜੀ ਦੇ ਲਾਗੂ ਕੀਤਾ ਹੈ ਅਤੇ ਮੈਂ ਆਪਣੀ ਸੁਤੰਤਰ ਸਹਿਮਤੀ ਅਤੇ ਇੱਛਾ ਨਾਲ ਇਹ ਹਲਫ਼ੀਆ ਬਿਆਨ ਦਿੱਤਾ ਹੈ।

ਵਰਨਾਕੂਲਰ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਦਸਤਖਤ ਕਰਨ ਵਾਲੇ ਬਿਨੈਕਾਰ/ਸਹਿ-ਬਿਨੈਕਾਰ ਦੇ ਦਸਤਖਤ/ਅੰਗੂਠੇ ਦੀ ਨਿਸ਼ਾਨੀ _____ ਮਿਤੀ: _____ ਸਥਾਨ: _____ ਨਾਮ: ਸ਼੍ਰੀਮਾਨ/ਮਿਸ. _____ [ਘੋਸ਼ਣਾਕਰਤਾ (ਬ੍ਰਾਂਚ/ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਮੈਨੇਜਰ/ਕਰਜ਼ਾਦਾਤਾ ਦਾ ਅਧਿਕਾਰੀ)] ਰਿਣਦਾਤਾ ਦੇ ਅਧਿਕਾਰੀ ਦੇ ਦਸਤਖਤ: _____ ਨੋਟ:

- ਇਹ ਘੋਸ਼ਣਾ ਉਦੋਂ ਲਈ ਜਾਵੇ ਜਦੋਂ ਕਰਜ਼ਦਾਰ ਅੰਗਰੇਜ਼ੀ ਨਾ ਸਮਝਦਾ ਹੋਵੇ ਅਤੇ ਦਸਤਾਵੇਜ਼ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਹੋਣ।
- ਇਹ ਘੋਸ਼ਣਾ ਫਾਰਮ ਹੈ ਅਤੇ ਸਟੈਂਪ ਪੇਪਰ 'ਤੇ ਜਾਰੀ ਕਰਨ ਦੀ ਲੋੜ ਨਹੀਂ ਹੈ ਅਤੇ ਨਾ ਹੀ ਨੋਟਰਾਈਜ਼ ਕੀਤਾ ਜਾਏ।

SINDHI

انہڪسر III

سுகامي ٻولي ٻاٻت ٻلاڻ فآرم

मां, _____ उम्र _____ साल, पुट्ट / _____ धीउ / _____ ज़ाल या मुड़िस जो _____ में रहो _____

_____ (पतो) हिते हेठ दिनल तौर ते संजीदगी सां तस्दीक़ ऐं एलान कर्यो:

मूखे ECL Finance Limited/Edelweiss Retail Finance Limited (कर्ज़ दियंदड़) खां _____ रक़म जो कर्ज़ हासुल करण लाइ लागापयल समूरनि कर्ज़नि जे दस्तावेज़नि ऐं बियनि सभनि ट्रांजेक्शन दस्तावेज़नि जो मवाद मूखे मूहिंजे पहिंजे बोली में पड़हे, समझाओ ऐं बयान कयो वयो आहे, ऐं

मां हिते तस्दीक़ करियां थो ऐं एलान करियां थो तह कर्ज़ जे सभनि दस्तावेज़नि जे शर्तनि ऐं हिन जे मूहिंजे वास्तो ते असर खे समझण खां पोइ मू कर्ज़ जे दस्तावेज़नि ते पहिंजे दस्तख़त मुक़ामी ज़बान में कयो आहे ऐं मां हिते क़बूल करियाँ थो तह मां कर्ज़नि जे सभनि शर्तनि ऐं इन्हं जे क्लोज ते अमल कंदस।

मां वधीक तस्दीक करियां था ऐं एलान करियां थो तह मू बगैर कंहि गैर मुनासिब असर, गलत बयानी या धोखाधड़ी जे हिन एलान ते अमल कयो आहे ऐं मू हिन हलफ नामों पहिंजे आज़ाद रज़ामंदी ऐं मर्ज़ी सां दिनो आहे।

दरख्वास्त कंदड़ /शरीक-दरख्वास्त कंदड़ जे मुक़ामी ज़बान में दस्तख़त/अंगूठे जो निशान _____

तारीख: _____

जगह: _____

नालो: मिस्टर / मोहतरमा _____ [एलान कंदड़ (ब्रांच/रिलेशनशिप मैनेजर/ कर्ज़ दियंदड़ जो ऑफिसियल)]

कर्ज़ दियंदड़ जे ऑफिसियल जे दस्तख़त: _____

नोट:

- ही ऐलान लाज़मी तौर ते वरतो वजे थो जिते कर्ज़ वठंदड़ अंग्रेजी न समझे ऐं दस्तावेज़ अंग्रेजी में आहिन
- ही हिक एलान फार्म आहे ऐं इन जे इस्टेम्प पेपर ते तयार करण जे ज़रूरत नाहे ऐं न ई नोटरी करण जे ज़रूरत आहे

URDU

III ضمیمہ
 وطنی اعلامیہ فارم
 میں، _____ عمر _____ سال، بیٹا/بیٹی/شریک حیات سکونت _____
 (اس طرح سنجیدگی سے تصدیق کرتا ہوں اور مندرجہ ذیل اعلان کرتا ہوں
)قرض دہندہ (سے _____ کی رقم کا قرض حاصل کرنے سے متعلق تمام قرض کے دستاویزات اور دیگر تمام لین دین کے دستاویزات کے مندرجات کو پڑھ کر سنایا گیا ہے ECL Finance Limited/Edelweiss Retail Finance Limited مجھے اور مجھے اس زبان میں بیان کیا گیا ہے جو مجھے معلوم ہے، اور
 میں اس کے ذریعے توثیق کرتا ہوں، تصدیق کرتا ہوں اور اعلان کرتا ہوں کہ میں نے قرض کے تمام دستاویزات کی شرائط و ضوابط کو سمجھنے کے بعد مقامی زبان میں قرض کے دستاویزات پر اپنے دستخط کر دیے ہیں اور اس کے میرے مفادات پر اثرات ہیں اور میں اس کے ذریعے قرض اور اسی کی شقوں کے تمام شرائط و ضوابط کی پابندی کرنے سے اتفاق کرتا ہوں۔
 میں مزید تصدیق کرتا ہوں اور اعلان کرتا ہوں کہ میں نے اس اعلان پر بغیر کسی غیر ضروری اثر و رسوخ، جبر، غلط بیانی یا دھوکہ دہی کے عمل کیا ہے اور میں نے یہ حلف نامہ اپنی آزاد رضامندی اور مرضی سے دیا ہے۔

_____ مقامی زبان میں دستخط کرنے والے درخواست دہندہ/شریک درخواست گزار کے دستخط/انگوٹھے کا نشان

تاریخ: _____

جگہ: _____

نام:محترم/محترمہ] _____اعلان کنندہ)قرض دہندہ کا برانچ/ریلیشن شپ منیجر/آفیشل]]

قرض دہندہ کے آفیشل کے دستخط: _____

- نوٹ:
- یہ اعلان ضروری ہے جہاں قرض لینے والا انگریزی نہیں سمجھتا ہو اور دستاویزات انگریزی میں ہوں۔
 - یہ ایک اعلانیہ فارم ہے جس کو اسٹامپ پیپر پر لاگو کرنے کی ضرورت نہیں ہے کہ اسے نوٹریائز نہ کیا جائے